



MEHTA HOUSING FINANCE LTD.

Registered Office: Plot No 1A Revenue Survey No 203, P1, Savarkundla Road, Taveda, Mahuva, Bhavnagar, Gujarat. 364290

Email: mehtahousingfinanceltd@gmail.com

CIN: L15100GJ1993PLC020699

June 1, 2022

To,
General Manager,
The Department of Corporate Services - CRD,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001

Dear Sir/Madam

Scrip Code: 511740

Subject: Newspaper Cutting of Abridged Audited Standalone Financial Results for the quarter and financial year ended March 31, 2022

In compliance with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Abridged Audited Standalone Financial Results for the quarter and financial year ended March 31, 2022, has been published in "Free Press Gujarat" and "Lokmitra" on June 1, 2022.

We are enclosing the newspaper clippings of the reporting in "Free Press Gujarat" and "Lokmitra" for your information and records.

Kindly take the above on record.

Thanking you.

Your faithfully

For Mehta Housing Finance Limited


Kinjal Kothari

Company Secretary & Compliance officer

Membership No: A60997

Encl: a/a

PM addresses 'Garib Kalyan Sammelan' in Shimla

Ahmedabad, Prime Minister Shri Narendra Modi addressed 'Garib Kalyan Sammelan' in Shimla, Himachal Pradesh. This novel public programme marking the completion of eight years of the government led by the Prime Minister is being organized across the country at State Capitals, District Headquarters, and Krishi Vigyan Kendras. The Sammelan conceptualizes elected public representatives across the country directly interacting with the public to get feedback about the various welfare programmes being run by the government.

The Prime Minister also released the 11th installment of financial benefits under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme. This will enable the transfer of an amount of around Rs. 21,000 crore more than 10 crore beneficiary farmer families. On this occasion, the Prime Minister also interacted with the beneficiaries of (PM-KISAN) across the country. Governor of Himachal Pradesh, Shri Rajendra Arlekar, Chief Minister of Himachal Shri Jai Ram Thakur, and Union Minister Shri Anurag Singh Thakur were among those present on the occasion in Shimla.

released benefits under the PM CARES for Children Scheme on the occasion of the completion of 8 years of the Government. He expressed his happiness for releasing the financial benefits under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme nationwide from Shimla. He thanked the people for giving him the opportunity to serve 130 crore citizens. The Prime Minister also conveyed his satisfaction on marking 8 years by taking up the responsibility of the children who lost both their parents to the Corona pandemic through PM CARES for Children yesterday. He said that the suggestion to be in

Himachal for this occasion was accepted by him with promptness as the State has been his Karmbhoomi. The Prime Minister said that he always sees himself as a member of the family of 130 crore citizens and not as a Prime Minister. Only when he signs a file does he take the responsibility of the Prime

Minister. As soon as that moment gets over, he said "I no longer remain Prime Minister and become the member of your family and Pradhan Sevak of the 130 crore citizens. If I am able to do anything for the country, it is only because of the blessings and good wishes of 130 crore citizens." An emotional Prime Minister said, "Getting connected with the hopes and aspirations of my family of 130 crore citizens, this family is all I have, you people are everything in my life and this life too is for you." The Prime Minister said that the government is completing its eighth year, he repeated his resolve again that he will do whatever he can, for the welfare of everyone, for the honour of every Indian, for the security of every Indian, and for the prosperity of every Indian for them to get a life of happiness and peace.

Gujarat Titans take out victory parade on open-top bus, meet state CM



Ahmedabad: Thousands of fans on Monday flooded the city's streets as Gujarat Titans took out a victory parade on an open-top bus to celebrate their title triumph in a memorable maiden season in the IPL. On the same day, Gujarat Chief Minister Bhupendra Patel hosted the state's newly-crowned Indian Premier League champions and felicitated them. "Got a chance to interact with players of IPL 2022 winners Gujarat Titans. They presented me a bat with signatures of all squad members. The proceeds from it will be used in the education of the daughters of the state. Congratulations to all the players," the chief minister wrote on his Twitter handle.

In Sunday's final, played at the gargantuan Narendra Modi Stadium, the Titans defeated inaugural IPL winners Rajasthan Royals by seven wickets to cap off a dream season. In doing so, they became the first team, since Royals themselves in 2008, to win the tournament in their very first season. On Tuesday, the team is going to Mumbai where its owners are throwing a party to celebrate the victory. After the win, players parted at the stadium till 3am, and there was another round of celebrations at the team hotel. They went to their rooms at 6 in the morning. All the families joined the players and for some like Shubman Gill, his father was present. On the same day, Gujarat Chief Minister Bhupendra Patel hosted the state's newly-crowned Indian Premier League champions and felicitated them. "Got a chance to interact with players of IPL 2022 winners Gujarat Titans.

Rajasthan Royals by seven wickets to cap off a dream season. In doing so, they became the first team, since Royals themselves in 2008, to win the tournament in their very first season. On Tuesday, the team is going to Mumbai where its owners are throwing a party to celebrate the victory. After the win, players parted at the stadium till 3am, and there was another round of celebrations at the team hotel. They went to their rooms at 6 in the morning. All the families joined the players and for some like Shubman Gill, his father was present. On the same day, Gujarat Chief Minister Bhupendra Patel hosted the state's newly-crowned Indian Premier League champions and felicitated them. "Got a chance to interact with players of IPL 2022 winners Gujarat Titans.

ANJANI SYNTHETICS LIMITED
 CIN: L1171G1984PLC007048
 Registered Office: 221 (Maliya), New Cloth Market, O/S, Ralpur Gate, Ahmedabad- 380002, Gujarat
 Phone: 079- 22173181 Email: info@anjansynthetics.com Website: www.anjansynthetics.com

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2022 (Rs. In Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter ended		Year ended	
		31-03-2022	31-12-2021	31-03-2021	31-03-2021
		Audited	Unaudited	Audited	Audited
1	Total Income from Operations	10,972.03	9,744.96	10,347.63	30,654.47
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	179.93	131.49	128.77	485.37
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	179.93	131.49	128.77	485.37
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	174.16	94.02	78.14	400.27
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	290.52	94.02	126.68	516.63
6	Equity Share Capital	1,475.00	1,475.00	1,475.00	1,475.00
7	Reserves (including Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	6,005.67	5,489.95
8	Earnings Per Share (of Rs. 10/- each)	(Not Annualised)	(Not Annualised)	(Not Annualised)	(Annualised)
1	Basic	1.18	0.64	0.53	2.71
2	Diluted	1.18	0.64	0.53	2.71

Notes:
 1. The above Results have been reviewed by the audit committee and approved by the Board of Directors at their meetings held on 30/05/2022. The statutory auditor of the Company has reviewed the said result. The Auditors have carried out audit of the financials for the quarter and for the financial year ended on 31.03.2022 as required under Regulation 33 of the SEBI (LODR) Regulations 2015 and the related unmodified Audit Report on the same forwarded to the Stock.
 2. Operations of the Company falls under single reportable Segment i.e. "TEXTILE".
 3. The figures for corresponding previous periods have been regrouped/ rearranged wherever necessary. Figures for standalone financial results for the quarter ended 31st, March 2022 as reported in these financial results, are the balancing figures between audited figures in respect of full financial year and published year to date figures upto the end of the third quarter of the financial year.
 For, Anjani Synthetics Limited
 Vasude S. Agarwal
 (Managing Director)
 (DIN-11491403)

Place : Ahmedabad
 Date : 30.05.2022

GUJARAT NATURAL RESOURCES LIMITED
 Regd. Office : 3rd Floor, A Wing, Gopal Palace, Opp. Ocean Park, N. Nehru Nagar, Satellite Road, Ahmedabad-380015
 CIN: L27100GJ1991PLC016158

EXTRACT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2022. (Rs. In Lakhs)

PARTICULARS	Quarter ending	Previous Quarter ending	3 Year to date	
			Corresponding months ended in the previous year	31/03/2022
	31/03/2022	31/12/2021	31/03/2021	31/03/2022
	Audited	Unaudited	Audited	Audited
Total Income from operations	410.45	169.50	257.36	946.19
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-71.54	-207.38	-90.02	-440.37
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-71.54	-207.38	-90.02	-440.37
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-71.54	-207.38	-90.02	-409.48
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-71.54	-207.38	-90.02	-409.48
Equity Share Capital	8025.16	8025.16	5625.16	8025.16
Other Equity	-	-	-	377.19
Earnings Per Share (before extraordinary items) (of Rs.10/- each) (not annualised)	-0.09	-0.26	-0.16	-0.51
Basic	-0.09	-0.26	-0.16	-0.51
Diluted	-0.09	-0.26	-0.16	-0.51
Earnings Per Share (after extraordinary items) (of Rs.10/- each) (not annualised)	-0.09	-0.26	-0.16	-0.51
Basic	-0.09	-0.26	-0.16	-0.51
Diluted	-0.09	-0.26	-0.16	-0.51

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2022 (Rs. In Lakhs)

PARTICULARS	Quarter ending	Previous Quarter ending	3 Year to date	
			Corresponding months ended in the previous year	31/03/2022
	31/03/2022	31/12/2021	31/03/2021	31/03/2022
	Audited	Unaudited	Audited	Audited
Total Income from Operations	0.00	0.00	0.00	0.00
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-29.65	-3.07	-27.89	-79.61
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-29.65	-3.07	-27.89	-79.60

Notes:
 1. Above is an extract of the detailed format of Quarterly and year ended Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and year ended Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.gnril.in)
 For, GUJARAT NATURAL RESOURCES LTD.
 SD/-
 SHALIN A. SHAH
 MANAGING DIRECTOR, DIN: 00294747

Date : 30/05/2022
 Place : Ahmedabad

Maruti Infrastructure Limited
 CIN: L65910GJ1994PLC023742
 Regd. Office: 802, Summit Building, Opp. Icon Mega Mall, S. G. Highway, Ahmedabad, Gujarat-380015, India. Ph: 079-26860740,
 E-mail:maruti_infra@yahoo.com, Website: www.marutinfra.in

Extract of Audited Financial Results for the Quarter and Financial Year ended on 31st March, 2022 (Rs in Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter ended		Year ended	
		31/03/2022	31/03/2021	31/03/2022	31/03/2021
		Audited	Unaudited	Audited	Audited
1	Total Income from Operations	1,196.66	968.97	2,550.70	3,256.12
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	74.14	183.58	84.17	100.45
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	74.14	183.58	84.17	100.45
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	54.17	155.73	51.57	70.96
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	54.17	155.73	51.57	70.96
6	Equity Share Capital (Face value of Rs 10 each)	1,250	1,250	1,250	1,250
7	Other Equity	-	-	1,029.93	978.36
8	Earnings per equity shares (of Rs 10/- each) (for discontinued & continuing operations)	0.43	1.25	0.41	0.57
1	Basic	0.43	1.25	0.41	0.57
2	Diluted	0.43	1.25	0.41	0.57

Notes:
 1. The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter and financial year ended on 31st March, 2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results for the quarter and financial year ended on 31st March, 2022 are available on the Stock Exchange website i.e. www.bseindia.com and on the website of the company i.e. www.marutinfra.in.
 For Maruti Infrastructure Limited
 SD/-
 Nimesh D Patel
 Chairman & Managing Director
 (DIN : 00185400)

Place: Ahmedabad
 Date: 30th May, 2022

Minister. As soon as that moment gets over, he said "I no longer remain Prime Minister and become the member of your family and Pradhan Sevak of the 130 crore citizens. If I am able to do anything for the country, it is only because of the blessings and good wishes of 130 crore citizens." An emotional Prime Minister said, "Getting connected with the hopes and aspirations of my family of 130 crore citizens, this family is all I have, you people are everything in my life and this life too is for you." The Prime Minister said that the government is completing its eighth year, he repeated his resolve again that he will do whatever he can, for the welfare of everyone, for the honour of every Indian, for the security of every Indian, and for the prosperity of every Indian for them to get a life of happiness and peace.

The Prime Minister lamented that before 2014, the earlier government had considered corruption as an essential part of the system, then instead of fighting corruption, the government had succumbed to it, then the country was watching that the money for schemes was looted before reaching the needy. He added that today due to the trinity of Jan Dhan-Aadhaar & Mobile (JAM), the money is reaching the beneficiary directly in their Jan Dhan bank accounts. Earlier there was a compulsion to suffer smoke in the kitchen, today there is a facility to get LPG cylinders from the Ujjwala scheme. Earlier there was the shame of open defecation now poor have the dignity of toilets. Earlier there was helplessness to raise money for treatment, today every poor has the support of Ayushman Bharat. Earlier there was a fear of triple talaaq, now there is the courage to fight for one's rights. The Prime Minister noted that the welfare schemes, good governance, and welfare of the poor (Seva Sushasan aur GareebKalyan) have changed the meaning of government for the people.

Now the government is working for the people. Be it PM housing schemes, scholarships, or pension schemes, with the help of technology, the scope of corruption has been minimized. He said that the Government is trying to give a permanent solution to the problems which were earlier assumed to be permanent. He said Direct Benefit Transfer put an end to the injustice of paragrah and leakage by removing 9 crore fake names from the benefit rolls. The Prime Minister said when the daily struggle of the poor has reduced when he is empowered, then he gets involved with new energy to remove his poverty. With this thinking, our government started empowering the poor from day one. We tried to reduce every single worry in his life, he added.

PHYSICAL POSSESSION NOTICE

ICI Home Finance
 Registered office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai- 400051
 Corporate Office: ICICI HFC Tower, JB Nagar, Anandhi Kurla Road, Anandhi East, Mumbai- 400059
 Branch Office: Office No. 21, 2nd Floor, Plot No. 8/B, Gijubhai Badhekar Marg, Opp. Dakshinamurti School, Waghawadi Road, Bhavnagar- 364002
 Wharod Office: Office No. 21, 2nd Floor, Plot No. 8/B, Gijubhai Badhekar Marg, Opp. Dakshinamurti School, Waghawadi Road, Bhavnagar- 364002

The undersigned being the Authorized Officer of ICICI Home Finance Company Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (1) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Home Finance Company Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of property/ Date of Possession	Date of Demand in Demand Notice (Rs.)	Name of Branch
1.	Firoj Ahmad Shekh (Borrower), Mumtaj Begam Firoj Ahmad Shekh (Co-Borrower), NIHRJL0000835275	Plot No. 28 and 29, Shiv Tenament, Gokul Nagar 1, C.S. No. 3105/29 and 3105/30 Sheet No. 99, R.S. No. 228, Rajula, Gujarat- 364560. (Addressing an Area of 687.5 Sq. Mtrs. and 110-96 Sq. Mtrs.) Bounded By: North: Plot No. 27, South: Plot No. 29, East: Plot No 30 and 31, West: Road. Date of Possession- 26-May-22	31-03-2018 Rs. 17,10,071/-	Bhavnagar-B

The above-mentioned borrower(s)/ guarantor(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.
 Date : June 01, 2022
 Place: Rajula
 Authorized Officer
 ICICI Home Finance Company Limited

MEHTA HOUSING FINANCE LTD.

EXTRACT OF STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER & FINANCIAL YEAR ENDED MARCH 31, 2022 (Rs. In Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)
1.	Total Income from Operations	0.00	0.00	0.00	0.00
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(3.28)	(5.87)	95.44	(10.82)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(3.28)	(5.87)	95.44	(10.82)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(3.28)	(5.87)	95.44	(10.82)
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(3.28)	(5.87)	95.44	(10.82)
6.	Equity Share Capital	308.20	308.20	308.20	308.20
7.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	(0.106)	(0.190)	3.097	(0.351)
1)	Basic:	(0.106)	(0.190)	3.097	(0.351)
2)	Diluted:	(0.106)	(0.190)	3.097	(0.351)

Notes:
 1. The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said results along with the Auditors Report of the Statutory Auditors are available on BSE Limited (BSE) website (URL: www.bseindia.com) and on the Company's website (URL: www.mehtahousing.com). The Audited Financial Results were reviewed by the Audit Committee and by the Board of Directors at their Meeting held on May 30, 2022.
 2. Previous years' Quarters figures have been regrouped/ rearranged wherever necessary to make them comparable.
 Date: 31.05.2022
 Place: Mahuva
 For Mehta Housing Finance Limited
 Vishal Ruparel
 Chairman & Managing Director
 DIN: 00077787

Zota Health Care Limited
 CIN: L24232GJ1999PLC028352
 Registered office: Zota House, 2/896, Hira Modi Street, Sagarimurti, Surat-395002, Gujarat
 Email: info@zotahhealthcare.com Website: www.zotahhealthcare.com Ph: +91-261-2331601

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2022 (Rs. In Lakhs, except per share data)

Sr. No.	Particulars	STANDALONE		CONSOLIDATED	
		Quarter ended March 31, 2022 (Audited)	Year ended March 31, 2022 (Audited)	Quarter ended March 31, 2021 (Audited)	Year ended March 31, 2021 (Audited)
1	Total income from operations	3175.26	31555.33	3064.26	31333.64
2	Net Profit for the period (before tax, exceptional and/or extraordinary items)	44.81	2419.14	(81.01)	(134.42)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	44.81	2419.14	(81.01)	(134.42)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	34.74	1058.01	(68.07)	(101.09)
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	40.98	1077.84	(64.43)	(124.78)
6	Equity Share Capital (Face value of Rs. 10/- each)	2516.03	2516.03	2516.03	2516.03
7	Reserves (including Revaluation Reserve)	662.42	4181.18	-	6446.65
8	Earnings Per Share (face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)	0.14	4.25	(0.28)	(0.40)
1	Basic:	0.14	4.25	(0.28)	(0.40)
2	Diluted:	0.14	4.25	(0.28)	(0.40)

Notes:
 1. The above is an extract of the detailed format of Quarterly and Year to Date Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year to Date Financial Results are available on the websites of the National Stock Exchange of India at www.nseindia.com and on the website of the Company at the www.zotahhealthcare.com.
 2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on May 30, 2022.
 3. The Audit as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.
 4. The Board of Directors in its meeting held on May 30, 2022 has recommended the final dividend at the rate of 15% i.e. Rs. 1.5/- per equity share for the financial year 2021-22, subject to the approval of the shareholders at the ensuing Annual General meeting of the Company.
 For and on behalf of Board of Directors of Zota Health Care Limited
 SD/-
 Mowsh Zota
 (Managing Director)
 DIN: 07625219

Date: 31.05.2022
 Place: Surat

